



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૧૧/૨૦૧૮ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૫૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૪ કેસ કરી, ૭૨ વ્યક્તિઓને ઝડપી, ૫૬૫ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગારધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩,૧૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૫૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૯૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૩૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૨૨૫૨/૧૮

વસ્ત્રાપુર : રાજેશભાઈ જ્યંતીલાલ પંડ્યા (રહે.મૃદુલ પાર્ક દસ બંગલાની બાજુમાં ગુલબાઈ ટેકરા, આંબાવાડી) એ તા.૧૭/૧૧/૧૮ ના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે ઓક્ટોબર/૨૦૧૭ થી તા.૧૮/૫/૧૮ સુધીના સમયગાળા દરમ્યાન થલતેજ ચાર રસ્તા, ટાઇટેનીયમ સ્ક્વેર બી/૩૦૮ ખાતે આરોપી (૧) શિવમ ધનંજયભાઈ પરીખ (હાલ રહે. જર્મની) (૨) ધનંજયભાઈ પરીખ (રહે. કલહાર બંગ્લો સેક્ટર-૨ શીલજ) એ ભેગામળી રાજેશભાઈના દિકરા ને જર્મની ખાતે કંપની ખોલી વેપાર ધંધામાં સેટ કરવાની વાત કરી વિશ્વાસ કેળવી રાજેશભાઈ પાસે થી “નીમ્બસ ટ્રેડીંગ જી.એમ.બી.એચ” નામની કંપની ખોલવા સારૂ પાવર લઇ કંપની ના એમ.ડી. બની કંપની ના એકાઉન્ટ માંથી નાણા ઉપાડી, નક્કી કરેલ સ્ટોર “નીમ્બસ ટ્રેડીંગ જી.એમ.બી.એચ કંપની” માટે ભાડે લેવાની જગ્યાએ આરોપીઓએ પોતાની “માયરા ટ્રેડીંગ જી.એમ.બી.એચ” કંપની ના નામે ભાડે રાખી, રાજેશભાઈના ૧,૦૦,૭૨૯/- યુરો (ભારતીય ચલણમાં રૂપિયા આશરે ૮૨,૦૦,૦૦૦/-) થાય છે તે વાપરી નાખી, રાજેશભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.આર.ભરવાડ ચલાવે છે.

કૃષ્ણનગર : કનુભાઈ નાથાભાઈ વાળંદ (ઉ.વ.૫૨)(રહે. યુવરાજપાર્ક સોસાયટી, કઠવાડા રોડ નવા નરોડા) એ તા.૧૭/૧૧/૧૮ ના રોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૪/૧૧/૧૮ રાતના ૧૦/૦૦ થી તા.૧૬/૧૧/૧૮ સાંજના ૭/૩૦ વાગ્યા દરમીયાન પોતાના મકાનના દરવાજાનુ તાળુ તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી તીજોરી માંથી સોના-ચાંદી ના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૯૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.જી.વહોનીયા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.